

**જાહેર ખબર**  
**સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,**  
**નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ.**  
**બ્લોક નં. ૪, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર**

**વિદેશ અભ્યાસ લોન યોજના** (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અને આર્થિક રીતે પછાતવર્ગ) અને **કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના** (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ) માટે વર્ષ ૨૦૨૧-૨૨ માં લક્ષ્યાંક મુજબની અરજીઓ મેળવવા માટે તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી ઓનલોઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઓનલાઇન જ સ્વીકારવાની હોય વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓએ [esamajkalyan.gujarat.gov.in](http://esamajkalyan.gujarat.gov.in) વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

**વિદેશ અભ્યાસ લોન યોજના :-**

(૧) મહત્તમ લોનની રકમ રૂ.૧૫.૦૦લાખ (પંદર લાખ), વાર્ષિક ૪ ટકા વ્યાજના દરે લોન. (૨) વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અરજી સબમીટ કરવાની રહેશે. (૩) ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે (SEBC). (૪) સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે (SEBC અને EBC). (૫) ધોરણ-૧૨ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ માં SEBC માટે લઘુત્તમ ૬૫%, NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે લઘુત્તમ ૫૫ %. (૬) સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં SEBC અને EBC માટે લઘુત્તમ ૬૦%, NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે લઘુત્તમ ૫૦ %. (૭) સા.શૈ.પ.વર્ગ (SEBC) માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૧૦.૦૦લાખથી ઓછી. અને આ.પ.વર્ગ (EBC) માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦લાખ કે તેથી ઓછી. (૮) લોન મંજૂર થયેથી વાલી અથવા જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.

**કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લોન યોજના :-**

(૧) મહત્તમ લોનની રકમ રૂ.૨૫.૦૦લાખ (પચ્ચીસ લાખ), વાર્ષિક ૪ ટકા વ્યાજના દરે. (૨) ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. (૩) તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધી જ શૈક્ષણિક, ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઈએ. (૪) આવક મર્યાદા નથી. (૫) લોન મંજૂર થયેથી વાલી અથવા જામીનદારની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.

**મહત્વની સુચનાઓ :**

૧. અરજી કર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી અરજીની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને

લાગુ પડતી, જે તે જિલ્લાની જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.)ની કચેરીમાં બે નકલમાં

અરજી કર્યાના દિન ૧૫માં જમા કરાવવાની રહેશે.

૨. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઈ જશે.

૩. વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો, નમુનાનુ ફોર્મ, નિયત સોગંદનામા, જરૂરી જોડવાના આધારોની યાદી, FAQs [esamajkalyan.gujarat.gov.in](http://esamajkalyan.gujarat.gov.in) ના DASHBOARD પર નિયામક વિકસતી જાતિ કલ્યાણ માં આપેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે.

સ્થળ :- ગાંધીનગર

તારીખ :-૨૭/૦૫/૨૦૨૧

એન. એ. નિનામા (IAS)

નિયામક

વિકસતી જાતિ કલ્યાણ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર